

B.Com. Semester - 1 (CBCS) Examination
Jan/Feb.-2022 (NEW COURSE)
FINANCIAL ACCOUNTING - 1(CORE)

Time: 1:30 Hours

Marks: 42

Instructions:

1. Figures to the right indicate marks.
2. There are five questions in the question paper.
3. Answer any three of the following questions.

પ્રશ્ન-૧ રામ અને ભરતની પેઢી તા.1-4-2020 નાં રોજ કૃષ્ણ અને બલરામની પેઢી સાથે સંયોજન કરે છે. ભાગીદારો (૧૪)
 ૩:૨ ના પ્રમાણમાં નફો-નૂકશાન વહેંચતા હતા. સંયોજન અગાઉ પેઢીનું પાકું સરવૈયું નીચે મુજબ હતું.

મૂડી-દેવા	રકમ રૂ.	મિલકત-લેણાં	રકમ રૂ.
મૂડી ખાતાં :-		મશીનરી	40,000
રામ	45,000	ફર્નિચર	14,000
ભરત	30,000	સ્ટોક	17,000
લેણદારો	15,000	દેવાદારો- 30,000	
નફા નૂકશાન ખાતું	10,000	- ઘાલખાદ્ય અનામત - 1000	29,000
	1,00,000		1,00,000

સંયોજનની શરતો નીચે મુજબ હતી.

1. પાઘડીની કિંમત રૂ. 15,000 ગણવી.
2. મશીનરીની કિંમત રૂ. 49,000ની કિંમતે અને સ્ટોક રૂ. 15,000 ની કિંમત લઈ લેવો.
3. ફર્નિચર નવી પેઢીએ લેવું નહિ
4. દેવાદારો પર ઘાલખાદ્ય અનામત 10% સુધી વધારવી

રામ અને ભરતના ચોપડે તૈયાર કરો.

1. નફા-નૂકશાન હવાલા ખાતું
2. ભાગીદારોનાં મૂડી ખાતાં
3. નવી પેઢીનું ખાતું

પ્રશ્ન-૨ શ્રીમાન દેવ કેરીના 1,000 બોક્ષ આડતથી વેચવા મોકલ્યા. દરેક બોક્ષમાં કેરીના 100 નંગ ધરાવે છે. દરેક (૧૪)
 બોક્ષની પડતર કિંમત રૂ. 900 હતી. નૂર ભાડું વીમો વગેરેના દેવે બોક્ષ દીઠ રૂ. 100 લેખે ચૂકવ્યા. રસ્તામાં એક બોક્ષ ગુમ થઈ ગયું અને દેવે વીમા કંપની સમક્ષ દાવો રજૂ કર્યો વીમા કંપનીએ દાવા અંગે રૂ. 570 મંજૂર કર્યા.

આડતિયા એ બાકીના બોક્ષની ડિલિવરી લીધી અને તે અંગે રૂ. 49,950 ચૂકવ્યા, તદઉપરાંત તેણે રૂ. 22,500 વેચાણ ખર્ચના ચૂકવ્યા તેણે 925 બોક્ષ દીઠ રૂ. 1200 ના ભાવે વેચ્યાં.

આડતિયાને 2% સાદી આડત અને 1% આસામી આડત આપવામાં આવે છે.

માલઘણી દેવના ચોપડે (1) આડત માલખાતું (2) આડતિયાનું ખાતું તૈયાર કરો.

પ્રશ્ન-૩ અ, બ અને ક ૫:૩:૨ નો નફા-નૂકશાનથી રૂ. ૨૫,૦૦,૦૦૦ ની કિંમતનું એક મકાન બાંધવા માટેના સાહસમાં (૧૪) જોડાયા.

દરેક ભાગીદારે રૂ. ૫,૦૦,૦૦૦ લેખે કુલ રૂ. ૧૫,૦૦,૦૦૦ સંયુક્ત બેંકમાં ભર્યા.

સંયુક્ત સાહસના ખર્ચ તથા અન્ય વિગતો નીચે મુજબ છે.

1. સંયુક્ત બેંક ખાતામાંથી ચૂકવ્યાં.
માલસામાન 10,00,000
મજૂરીના 4,00,000
પેટા કોન્ટ્રાક્ટના 2,00,000
2. “અ” રૂ. ૫૦,૦૦૦, આર્કિટેક્ટ ફીના ચૂકવે છે.
3. “બ” રૂ. ૫૦,૦૦૦ નો માલ પોતાના સ્ટોકમાંથી પૂરો પાડે છે.
4. બાંધકામ દરમિયાન થયેલ રૂ. ૨,૦૦,૦૦૦ નો માલ “ક” લઈ લે છે.
5. બાંધકામ પુરું થતાં કરાર આપનારે કરાર કિંમત ચૂકવી આપી.

ઉપરની માહિતી ઉપરથી તૈયાર કરો.

1. સંયુક્ત સાહસ ખાતું
2. સંયુક્ત બેંક ખાતું
3. ભાગીદારો નાં મૂદી ખાતાં

પ્રશ્ન-૪ આન, બાન અને શાન એક પેઢીના ભાગીદારો હતા. તેઓ નફો-નૂકશાન અનુક્રમે ૨:૨:૧ ના પ્રમાણમાં (૧૪) વહેંચતા હતા તા. ૩૧-૩-૨૦ નાં રોજ તેમનું પાકું સરવૈયું નીચે પ્રમાણે હતું.

મૂડી-દેવાં	રકમ રૂ.	મિલકતો	રકમ રૂ.
મૂડી:-		જમીન મકાન	૧,૫૦,૦૦૦
આન-૧,૦૦,૦૦૦		મશીનરી	૬૫,૦૦૦
બાન- ૭૦,૦૦૦		સ્ટોક	૩૨,૦૦૦
શાન- ૬૦,૦૦૦	૨,૩૦,૦૦૦	દેવાદારો	૬૮,૦૦૦
લેણદારો	૮૦,૦૦૦	રોકડ સિલક	૧૦,૦૦૦
બેંક લોન (મશીનરીના તારણ પર)	૨૦,૦૦૦	નફા-નૂકશાન ખાતું	૫,૦૦૦
	૩,૩૦,૦૦૦		૩,૩૦,૦૦૦

તા. ૧-૪-૨૦૨૦ ના રોજ પેઢીનું વિસર્જન કરવામાં આવ્યું મિલકતોની ઉપજ નીચે પ્રમાણે મળી હતી.

પ્રથમ હપ્તો રૂ. ૯૭,૫૦૦, બીજો હપ્તો રૂ. ૮૨,૮૦૦

રૂ. ૪,૦૦૦ વિસર્જન ખર્ચ માટે અનામત રાખવામાં આવ્યા હતા. ખરેખર વિસર્જન ખર્ચ રૂ. ૩૦૦૦ થયો હતો.

ઉપરની માહિતી પરથી રોકડની હપ્તે હપ્તે વહેંચણી દર્શાવતું પત્રક તૈયાર કરો.

પ્રશ્ન-૫ ટૂંકનોંધ લખો. (કોઈપણ બે)

(૧૪)

1. ભાગીદારી પેઢીના સંયોજનના હેતુઓ જણાવો
2. સાદી આડત અને આસામી આડતનો તફાવત સમજાવો
3. રાશના હિસાબોની જૂદી જૂદી પદ્ધતિઓ
4. મૂડી વધારાની રીત

English Version

- Que-1 The firm of Ram and Bhart and the firm of Krishna and Balaram agreed to amalgamate on 1-4-2020 partners were sharing profit and losses in the ratio 3:2 before amalgamation the balance sheet of the firm was as follows. (14)

Liabilities	Rs.	Assets	Rs.
Capital A/c		Machinery	40,000
Ram	45,000	Furniture	14,000
Bhart	30,000	Stock	17,000
Creditors	15,000	Debtors - 30,000	
Profit-Loss A/c	10,000	- B.D.R - 1000	29,000
	1,00,000		1,00,000

The terms of Amalgamation were as under.

1. Good will was valued at Rs. 15,000
2. Machinery was to be taken over Rs. 49,000 and stock at Rs. 15,000
3. Furniture was not be taken over by the new firm
4. Bad Debts reserve to be raised to 10% on Debtors

Prepare in the Book of Ram and Bhart firm

1. P/L Adjustment A/c
2. Partner's Capital A/c and
3. New firm A/c

- Que-2 Shriman "Dev" sent 1,000 mango Boxes for consignment sale. Each Box contains 100 units of mango. The cost per mango Box is Rs. 900. Dev paid Rs. 100 per box for freight Rent, insurance etc. in tansit one Box lost and Shri "Dev" presented a claim for this insurance company sanction Rs. 570 as claim. (14)

The consigne received the remaning Boxes and for that he paid Rs. 49,950: moreover he paid Rs. 22,500 for selling expense. He sold 925 Boxes @ Rs. 1200 per Box.

The consigne is entited to get 2% simple-commission and 1% del-credere commission.

Prepare:-

1. Consignment A/c
2. Consigne A/c, in the book of consignor

- Que-3 A, B and C agreed to construct a building for Rs. 25,00,000; they decided to share profit or Loss in 5:3:2 respectively. (14)

They deposited Rs. 15,00,000. In the joint bank account as per Rs. 5,00,000 each partner.

Expenses were as under.

1. Amount paid from their joint bank account.
Material Rs. 10,00,000
Wages Rs. 4,00,000
Sub contract Rs. 2,00,000
2. Architect fee paid by "A" Rs. 50,000
3. Material supplied by "B" from his stock Rs. 50,000
4. On completion of the contract "C" purchased. Remaining material stock for Rs. 2,00,000
5. Contract price received as per agreement

From the above information. You are regvired to prepare:

1. Joint venture account
2. Capital account of the partners
3. Joint bank account

- Que-4 “Aan”, “Ban” and “Shan” were the partners in a firm. Sharing profit and losses in the ration of 2:2:1 respectively. The balance sheet of their firm as on 31st March 2020 is as under. (14)

Liabilities	Rs.	Assets	Rs.
capital:-		Land & Building	1,50,000
Aan- 100,000		machinery	65,000
Ban- 70,000		Stock	32,000
Shan- <u>60,000</u>	2,30,000	Debtors	68,000
creditors	80,000	Cash balance	10,000
Bank Loan (Againts Machinery)	20,000	Profit & Loss A/c (Debit)	5,000
	3,30,000		3,30,000

The firm was dissolved on 1-4-2020. The assets realized as under.

First instalment Rs.97,500, Second Instalment Rs. 82,800

From the cash on hand a sum of Rs. 4000, Was kept aside for dissolution expenses.

The actual expense was Rs. 3,000 and was paid off.

Prepare a statement showing piecemeal Distribution of cash.

- Que-5 Write short notes. (any two) (14)

1. Explain its objectives of Amalgamation of partnership
2. Explain the difference simple commi. And Del credere commission
3. Various method of recording. Joint venture transactions
4. Surplus capital method
